

## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ ખાતે ચાર દિવસીય કેન્દ્રીય તાલીમ યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ ખાતે કેન્દ્રના વૈજ્ઞાનિક (બાગાયત) શ્રીમતી અમીતાબેન પરમાર દ્વારા તા. ૧૨/૦૬/૨૦૧૮ થી તા. ૧૫/૦૬/૨૦૧૮ "આંબાની જુની ફળવાડીનું નવીનીકરણ" વિષય પરત્વે યોજાયો. આ કાર્યક્રમમાં આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના ગાડા, ખણસોલ તથા ઇસણાવ ગામના કુલ ૨૨ ખેડૂત ભાઈઓએ ભાગ લીધેલ.

તાલીમના પ્રથમ દિવસે કે.વિ.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. જી.જી. પટેલે તાલીમાર્થી ભાઈઓને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતાઓ અપનાવી ખર્ચ ઘટાડી આવક વધારવા અનુરોધ કરેલ. ત્યાર બાદ શ્રીમતી અમીતાબેન પરમાર દ્વારા ખેડૂત મિત્રોને જુની ફળવાડીના નવીનીકરણ વિષય પરત્વે તેમજ નવી આંબાવાડી બનાવવા અંગે વિવિધ ખેતી કાર્યોની વિસ્તૃતમાં પ્રાથમિક સમજ પુરી પાડવામાં આવી. તા. ૧૩/૦૬/૨૦૧૮ ના રોજ ખેડૂત ભાઈઓને આંબાની વિવિધ કલમો વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા તાલીમ આપેલ. ઉપરાંત આંબામાં ઘનીષ્ઠ રોપણી પદ્ધતિ વિશે વિસ્તૃતમાં સમજ આપેલ. તા. ૧૪/૦૬/૨૦૧૮ ના રોજ તાલીમાર્થીઓને ગાડા ગામના શ્રી ગોપાલભાઈ પટેલના ખેતર પર આંબાના જુના ઝાડનું નવીનીકરણ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા સમજાવેલ. તદુપરાંત નવી વાડી બનાવવા માટે ગોટલા અથવા કલમ રોપવાની પદ્ધતિ તેમજ બોર્ડોપેસ્ટ બનાવવાનું મેથડ ડેમોસ્ટ્રેશન બતાવેલ. તા. ૧૫/૦૬/૨૦૧૮ ના રોજ તાલીમાર્થીઓને આણંદ કૃષિ યુનિવર્સિટીના બાગાયત સંશોધન ફાર્મ ખાતે આંબાની જુની વાડીના નવીનીકરણ કરેલ ઝાડ તેમજ આંબાની અમૃતાંગ જાતની પણ વિસ્તૃતમાં ખાસીયતો સમજાવી તેના ફળાઉ ઝાડનું પ્રત્યક્ષ નિદર્શન બતાવેલ. ત્યારબાદ તેઓને બાગાયત વિભાગની ફળઝાડ નર્સરી, કુલછોડ નર્સરી તથા સરદાર પટેલ મ્યુઝિયમની મુલાકાત કરાવવામાં આવી.

## કેન્દ્રીય તાલીમ કાર્યક્રમની ઝાંખીઓ



વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રીનું ઉદ્દેશ બોધન



નૂતન કલમ પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન



આંબાવાડી બનાવવા અંગે વિવિધ ખેતી કાર્યોની પ્રાથમિક સમજ



આંબાની રોપણ પદ્ધતિ



બોર્ડોપેસ્ટ બનાવવાનું પ્રત્યક્ષ નિદર્શન



આંબાના જુના ઝાડનું નવીનીકરણ પ્રત્યક્ષ નિદર્શન



## આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મુલાકાત



બાગાયત સંશોધન ફાર્મ ખાતે આંબાના નવીનીકરણ કરેલ ઝાડનું પ્રત્યક્ષ નિદર્શન



બાગાયત નર્સરી ખાતે મુલાકાત



સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે મુલાકાત



સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે મુલાકાત